

Price : ₹ 5/-

# CIMS NEWS

# CARE & CURE

Volume-14 | Issue-155 | June 25, 2023



**Marengo CIMS  
Hospital**

[www.cims.org](http://www.cims.org)

## હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ વિશે માહિતી

તમે કીડની ટ્રાન્સપ્લાન્ટ વિશે તો સાંભળેલ હશે જ પણ હવે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ પણ તેટલું જ સામાન્ય થતું જાય છે. કેટલાક હૃદયના દર્દીનું હૃદય અત્યંત નબળું પડી જાય છે અને રોજુંદી જુંગાની જીવવામાં પણ અત્યંત શ્વાસ અને થાક લાગતો હોય છે. શ્વાસના કારણે વારંવાર હોસ્પિટલમાં દાખલ થતું પડતું હોય છે. આવી પરિસ્થિતિમાં દર વર્ષ ૫૦% દર્દીઓ અને પ વર્ષમાં ૮૦% દર્દીઓ મૃત્યુ પામતા હોય છે. જ્યારે આવા દર્દીને નવું હૃદય મળે છે ત્યારે તેને નવું જીવન મળે છે અને તે દર્દી સામાન્ય જિંદગી જવી શકે છે. હાર્ટ ટ્રાન્સપ્લાન્ટમાં દર્દીના નબળા હૃદયને કાઢીને તેની જગ્યાએ દાતા (Donor's Heart)ના હૃદયનું પ્રત્યારોપણ કરવામાં આવે છે.

### વિશ્વમાં અને ભારતમાં કેટલા હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે છે?

વિશ્વમાં દર વર્ષ સરેરાશ હજુ ૧૦,૦૦૦ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે છે. તેમાંથી મોટા ભાગના ઉત્તર અમેરિકા અને યુરોપમાં થાય છે. અત્યાર સુધીમાં લગભગ ૧,૨૦,૦૦૦ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે.

ભારતમાં અત્યાર સુધીમાં લગભગ ૧૩૨૮ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થયા છે. તાજેતરના વર્ષોમાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કાર્યક્રમ વધુ સુયોજિત રીતે થયો છે અને વિશ્વ ધોરણોની સમકક્ષ પરિણામ મળ્યા છે.

### જ્યારે હૃદય આ રીતે નબળું હોય ત્યારે તેની જરૂર પડે છે તેના કારણો આ પ્રમાણે છે:

૧. હાર્ટ એટેક પછી હૃદયની કાર્યક્ષમતા અતિ નબળી હોય અને એન્જિયોપ્લાસ્ટી અથવા બાયપાસ સર્જરીથી તે સુધરી શકે તેમ ન હોય.
૨. હૃદય ઉપર વાઇરસના કારણે સોજો આવવાથી હૃદય નબળું પડ્યું હોય (Dilated Cardiomyopathy)
૩. ખુબ જ આગળ વધી ગયેલ હૃદયના વાત્વની બીમારી
૪. જન્મજાત હૃદયની બિમારી કે જેમાં ઓપરેશનથી પણ હૃદયની સારવાર શક્ય ન હોય.
૫. હૃદયના ધબાકારની કે સ્નાયુની જૈનિક (Genetic) બિમારી કે જેમાં બીજા ઉપાય શક્ય ન હોય.

### ઉમેદવારી માટે મૂલ્યાંકન પ્રક્રિયા શું છે?

તેના માટે નિષ્ઠાંતોની ટીમ દર્દીની તપાસ કરે છે. આ ટીમ સામાન્ય રીતે કાર્ડિયોલોજીસ્ટ, કાર્ડિયોવાસ્ક્યુલર સર્જન, કાર્ડિયાક એનેસ્થેટીસ્ટ, ટ્રાન્સપ્લાન્ટ કોઓર્ડિનેટર, સોશિયલ વર્કર, ડાયેટિશિયન અને સાયકેટીસ્ટની બનેલી હોય છે. દર્દીની તબીબી પરીક્ષામાં એ પરિક્ષણોનો સમાવેશ થાય છે જેના હાર્ટ દર્દીની સમગ્ર શારીરિક સ્થિતિ જાણી શકાય છે. આ પરીક્ષણોમાં ઇસીજી, ઇકોકાર્ડિયોગ્રામ, કાર્ડિયાક કેથેટરાઇઝેશન, લીવર ટેસ્ટ, કીડની ટેસ્ટ, બ્લડ ટેસ્ટ, સ્કીન ટેસ્ટ, કેન્સર ટેસ્ટ, એક્સરસાઇજ ટેસ્ટ, ડેન્ટલ તપાસ, પલ્મોનરી ફંક્શન ટેસ્ટ, રિજેક્શન અટકાવવા માટે ટીસ્ચ્યુ અને બ્લડ ટાઇપીંગ વેગેરનો સમાવેશ થાય છે.



### દર્દી હૃદય માટે રાહ જોતો હોય ત્યારે બીમારી કથળે તો શું કરવું ?

ટ્રાન્સપ્લાન્ટ ટીમના સત્યો નિયમિત રીતે ઉમેદવારોનું મૂલ્યાંકન કરીને હોસ્પિટલાઇઝેશન હારા કે તેના વગર જરૂરિયાત પ્રમાણે તબીબી સારવારમાં ફેરફાર કરતા રહે છે. કેટલીક વખત મિકેનિકલ સકર્યુલેટરી સપોર્ટ (કુટ્રિમ હૃદય) ના ઉપયોગની જરૂર પડે છે.

### ટ્રાન્સપ્લાન્ટ સર્જરી પછી કેટલો સમય હોસ્પિટલમાં રહેવું પડશે?

કોઈ પણ કાર્ડિયાક સર્જરીની જેમ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ બાદ હોસ્પિટલમાં રિકવરીનો સમયગાળો આશારે ધર્થી ર સખાહનો હોય છે. કોઈ પણ પ્રકારની મુશ્કેલી પેદા થાય તો હોસ્પિટલમાં રોકાણ લંબાઈ શકે છે. આ સમયગાળામાં તમારી સતત એખરેખ રાખવામાં આવશે જેથી તમારું નવું હૃદય વ્યવસ્થિત કામ કરતું રહે અને સર્જિકલ પ્રક્રિયા પછી કોઈ જટિલતા પેદા ન થાય. દર્દીનું શરીર નવા હૃદયનો અસ્વીકાર ન કરે તે માટે પણ તમને ખાસ દવાઓ આપવામાં આવશે. ડિસ્ચાર્જ કરવામાં આવે તે પહેલા દર્દીએ દવાઓને કદ રીતે લેવી, કાપાની જગ્યાની કાળજી કદ રીતે લેવી અને આઉટપેશન્ટ કિલનિકની ફોલો-અપ મુલાકાતો વિશે દર્દીને અને તમારા પરિવારને માહિતી અને સૂચના આપવામાં આવશે.

### જુદી જુદી દવાઓ શેના માટે છે?

હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરાવનારે ખાસ પ્રકારની દવાઓ લેવી જરૂરી હોય છે. દરેક દવા ચોક્કસ થેરેપેચ્યુટીક કારણોસર હશે. તેઓ ચાર મુખ્ય કેટેગરીમાં આવે છે.

- ઇમ્યુનોસ્પેસન્ટ્સ: એવી દવાઓ શરીરની કુદરતી પ્રતિકારક શક્તિને ઘટાડી દે જેથી તે ટ્રાન્સપ્લાન્ટ (આરોપણ) કરાયેલા અવયવને સ્વીકારે
- એન્ટીબાયોટિક્સ, એન્ટીવાઇરલ અને ફંગિસાઇડ્સ: એવી દવાઓ જે તમારી કુદરતી રોગપ્રતિકારક શક્તિને નિષ્ક્રિય કરવામાં આવી હોય ત્યારે યેપણી શક્યતા ઘટાડે.

- વિટામિન, મિનરલ્સ અને પોષક સખીમેન્ટ્સ: તે તમારા શરીરને ઝડપથી સાજા થવામાં અને યોગ્ય કામગીરી જાળવી રાખવામાં મદદ કરે છે.

## કોરોનરી ધમનીઓની બીમારી અટકાવવા અને લોહીના દબાણનું નિયમન કરવાની દવાઓ.

મોટા ભાગની દવાઓ ટ્રાન્સપ્લાન્ટ સર્જરી પછી તાત્કાલિક લેવી પડશે. પ્રથમ વર્ષ દરમિયાન તમારી ટ્રાન્સપ્લાન્ટ ટીમ દવાઓને એડજસ્ટ કરી આપશો. તેમાં કેટલીક દવાઓના ડોઝ ઘટાડવામાં આવી શકે અથવા અમુક દવાઓ સાવ બંધ કરી શકાય.

## ટ્રાન્સપ્લાન્ટ બાદ કદ્ય મુશ્કેલીઓ માટે દ્યાન રાખવું જરૂરી છે?

ટ્રાન્સપ્લાન્ટ પછી બે સૌથી સામાન્ય મુશ્કેલીઓ થઈ શકે છે:


- **ચેપ** - ખાસ કરીને પ્રથમ કેટલાક મહિનામાં, દર્દીને ચેપના કોઇ પણ લક્ષણ હોય તો ટ્રાન્સપ્લાન્ટ કેન્દ્રનો સંપર્ક કરવો જરૂરી છે.
- **રિજેક્શન** - ટ્રાન્સપ્લાન્ટ બાદ તરત શરીર નવા છુદયનો અસ્વીકાર કરવા તમામ પ્રયાસ કરે છે. રિજેક્શનનો ખતરો ટાળવા માટે દર્દીને ઇમ્યુનોસપ્રેસન્ટ્સનો ઊંચો ડોઝ લેવો જરૂરી થતો હોય છે.

## રિજેક્શનની શી સારવાર છે?

જ્યારે રિજેક્શનની જાણકારી મળે ત્યારે તરત તેની સારવાર કરવી જોઈએ. મોટા ભાગના લોકોને તેમના પ્રથમ એપિસોડ માટે બ્રાન દિવસ માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે. તેની સારવારમાં પ્રેડનિસોન (અથવા સ્ટીરોઇદ) નો ઊંચો ડોઝ આપવામાં આવે છે જે ઇન્ટ્રાવેનસલી (નસ ડ્રારા) અથવા પ્રેડનિસોન ટેપલેટ વધારીને આપવામાં આવે છે. મોટા ભાગના કિસ્સામાં તેનાથી રિજેક્શન પ્રક્રિયા ઉલ્ટાવી શકાશે.

## દર્દી કેટલા સમયમાં કામ પર પરત જદ્ય શકે?

દર્દી કેટલા સમયમાં કામ પર પરત ફરી શકશો તેનો આધાર દર્દીને કેવું લાગે છે અને તે શું કામ કરે છે તેના પર રહેલો છે. સર્જરીના કાપાની જગ્યા મટી જાય અને તમને સારું લાગે પછી તરત દર્દીને કામ પર પરત જવા માટે ટ્રાન્સપ્લાન્ટ ટીમ સાથે વાત કરી દર્દીને તેઓ તૈયાર છે અનું લાગે અને ટ્રાન્સપ્લાન્ટ ટીમ પણ આ નિર્ણય તબીબી રીતે સુરક્ષિત હોવાનું માને પછી અમે દર્દીઓને કામ શરૂ કરવા પ્રોત્સાહિત કરીએ છીએ. સામાન્ય રીતે મોટા ભાગના લોકો સર્જરી પછી છ મહિના બાદ ફરીથી કામ શરૂ કરી શકે છે.



*Heart Transplant Patient*

## હાર્ટ ટ્રાન્સપ્લાન્ટનું પરિણામ કેવું આવે છે?

હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ બાદ ૩૦ ટકા દર્દીઓ ૧ વર્ષ જુવી શકતા હોય છે અને ૫૦ ટકા દર્દીઓ ૧૦ વર્ષ જુવી શકે છે. આ પરિણામો કિંડની ટ્રાન્સપ્લાન્ટના પરિણામ જેવા જ છે. એવા ઘણા દર્દીઓ છે જેઓ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ બાદ ૩૪ વર્ષ સુધી જુવીત રહ્યા હોય. તેનો આધાર દર્દીનું શરીર દાતાના છુદયને કેટલી સારી રીતે સ્વીકારે છે અને કેટલા ઓછા પ્રમાણમાં ઇમ્યુનોસપ્રેશન દવાઓનો ડોઝ લેવો પડે છે તેના પર રહેલો છે.

## સૌજન્ય



**ડૉ. ધીરેન શાહ**

હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સર્જરન

હૃદયની બાયોપાસના નિષ્ઠાંત

કાર્ડિયોથોરાસીક અને વાસ્ક્યુલર સર્જરન

MB, MS, MCh (CVTS)

(મો) ×૯૧-૮૮૨૫૫ ૭૫૬૩૩

Email: [dhiren.shah@cims.me](mailto:dhiren.shah@cims.me)



**ડૉ. મિલન ચગ**

હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કાર્ડિયોલોજીસ્ટ

હૃદયરોગના નિષ્ઠાંત

ઇન્ટરવેન્શનાલ કાર્ડીયોલોજીસ્ટ

MD, DM (Cardiology)

DNB (Cardiology), FACC

(મો) ×૯૧-૮૮૨૪૦ ૨૨૧૦૭

Email: [milan.chag@cims.me](mailto:milan.chag@cims.me)

## કરોડરજ્જુની ગાંઠોળી સારવાર


અમીનાબીબી( નામ બદલેલ છે) નો વર રિક્ષા ચલાવી ગુજરાન કરે છે. અમીનાબેન ને વાંસમાં દુખાવો થાય, ફાટફાટ કરે, છતાં પણ તે પોતાના કામ માં વ્યસ્ત રહે. આવું તો લગભગ ૩ વર્ષ ચાલ્યું. દુખાવા માટે આજુ બાજુથી કોઈ ગોળી લઈ લે. થોડો આરામ લાગે, એક દિવસ પાણી ભરતાં ભરતાં ફસકી પડ્યા બંધે પગ ખોટા પડી ગયા રીક્ષામાં તેમના પતિ હોસ્પિટલ લઈ ગયા. તપાસ કરતાં બરડાના પાછળના ભાગમાં કરોડરજ્જુમાં વરચે ગાંઠ હતી.

બીજા દિવસે ઓપરેશન કરી મેનીનજાઓમાં નામની ગાંઠ કાઢી, ચાર દિવસમાં અમીનાબેન ચાલતા થઈ ગયા. આજે લગભગ ૧૦ વર્ષ થઈ ગયા તેઓ તદ્દન નોર્મલ છે. આ લખવાનો આશાય માત્ર એ છે કે જલ્દી સયોટ નિદાન અને જરૂરી ઓપરેશન કેવા સારા પરિણામ આપી શકે છે.

કરોડરજ્જુમાં થતી મોટાભાગની ગાંઠ સામાન્ય હોય છે, માટે એક વખત સારી રીતે ઓપરેશન થઈ ગયા પછી બાકીની જુંદગી આરામથી ગાળી શકાય. અલબર્ટ આમાં પણ અપવાદ હોઈ શકે. જેમ કે કરોડના ઉપલા છેડે જ્યાં કરોડ અને ખોપરીનું જોડાણ હોય એ ભાગની ગાંઠ નું નિરાકરણ બરાબર ન થાય અને ગાંઠમાં એકદમ સોલો કોઈપણ કારણસર આવે તો શ્વાસ બંધ થઈ જતાં મૃત્યું થઈ શકે.

ગરદનના પાંચમાં મણકા સુધી ની ગાંઠો માં જાતના ભય રહેતા હોય છે અને એની ગાંઠો જાન લેવા નથી હોતી સિવાય કે લકવા, બહેરાશ, ચામડી, સાંઘા વગેરેની અને પેશાબના ભરાવા કે મળના ભરાવાને લીધે લાંબા ગાળે વિધનો ઉભા થઈ તે મૃત્યુંમાં પરિણામે.

કરોડમાં કેન્સરની ગાંઠો કર્યાં તો કરોડમાંજ ઉદ્ભવે અથવા બહારનું કેન્સર ફેલાઈ કરોડમાં આવે. આવા દર્દીઓ સંપૂર્ણ સારા ન થાય પણ ઓપરેશન અને બીજુ સારવાર થી રાહત જરૂર મળી શકે.



**બાળકોમાં સામાન્યત -** કરોડરજ્જુની ગાંઠો ઝાડી જોવામાં આવતી નથી અને જે ગાંઠો થાય છે તે એમાં મોટાભાગની જન્મભલત હોય છે. જન્મ પછી પણ ગાંઠો થાય છે. અને પુષ્ટ વયના જેટલી સામાન્ય નથી.

**ચોગ્ય નિરીક્ષણ -** પરીક્ષાણ કરી ગાંઠની જગ્યા અને માત્રા અને એનો પ્રકાર જાણી ચોગ્ય તૈયારી કરી ઓપરેશન કરવામાં આવે છે.

મોટેભાગો તો કરોડ ને પાછળના ભાગથી જ ખોલવામાં આવે, ઉપરના આવરણ અને કરોડ ના હાડકા નો અમૃત ભાગ કાઢી કરોડ રજ્જુસુધી પછીયાચ છે. અને દર્દીન અથવા દર્દીન વગર પણ ઓપરેશન થાય છે. સ્વસ્થ કરોડરજ્જુને સહેજ પણ છેડશાડ કર્યા વગર કયાં તો ટૂકડે ટૂકડે ક આખી ગાંઠ કાઢવામાં આવે છે.

કોઈક વખત જો ગાંઠમાં લોહીની નળીઓનું ગૂચ્યાં હોય તો ધીમે ધીમે એને બાળી નાખવામાં આવે છે. અમૃત સંજોગોમાં એવું પણ બને છે કે ગાંઠનો નાનો એવો ભાગ કાઢી ન શકાય કારણ કે અમ કરતાં દર્દીને ફાયદા કરતા નુકશાન થવાની શકાયતા રહે છે. કોઈક વખત એવું પણ બને કે લાંબા સમયને લીધે કે ગાંઠના પ્રકારના લીધે ઓપરેશન પછી પણ ફાયદો ન થાય આવા સંજોગોમાં મહંદ્યાંશે ઓપરેશનનો આશાય ગાંઠથી વધતું નુકશાન અટકાવવાનો હોય છે. જે સમજું ખૂબ જ જરૂરી છે.

કેન્સરની ગાંઠોમાં ઓપરેશન પછી કેન્સરની દવા (કિમોથેરેપી) કે કિરણોની સારવાર રેડીયેશન પણ આપવી પડે. આવા કિસ્સામાં પરિણામો કેન્સરના પ્રકાર અને ફેલાવા પર આધાર રાખે. જો વધારે મણકાના હાડકા ને કાઢવાની જરૂર પડે તો પછી કરોડરજ્જુના આધાર માટે ધાતુની પણી કે હાડકાનો માવો કે બંને ઓપરેશન પછી મૂકવા પડે. જરૂરી ઓપરેશન કર્યા પછી કસરત એ ખૂબ જ અગત્યાનું અને અનિવાર્ય અંગ છે. અંતિમ પરિણામ એના ઉપર ખૂબ જ આધાર રાખે છે.

અમૃત કિસ્સામાં જ્યાં ગાંઠ કરોડરજ્જુના આગળના ભાગમાં હોય કે સાથી મણકા પણ સંડોવાયેલા હોય એમાં ગરદન, ધ્યાતી કે પેટ માર્કફે પણ ઓપરેશન કરતું પડે છે. આ સં જોગોમાં થોરાસીક સર્જન કે ઓર્થોપેડીક સર્જનનો મદદ ની પણ જરૂર પડે છે. જો કે હાલતો ન્યૂરોસર્જન એટલા તાલીમબદ્ધ હોય છે. મોટાભાગના કિસ્સામાં તેઓ પોતે જ બદ્યું સંભાળી લેતા હોય છે.

મહિતમ અંશો ડિંધા સુવડાવી ઓપરેશન કરવાનું હોય છે એટલે એનેસ્થેટીસ્ટ ને પણ સામાન્ય કરતાં પણ વદ્યું સાવધાની રાખવી પડે છે. વળી દર્દીને જો, ડાયાબીટીસ, બલમેશર, હંદયરોગ, લોહી ગાંઠાવાની કિંયાનો વિકાર કે બીજા ભાગોમાં પણ કેન્સર ની અસર હોય તો એની અસર પરિણામ ઉપર પડી શકે છે.

કરોડરજ્જુની ગાંઠની પૂરી સમજ મેળવી પૂરી તપાસ કરાવી ચોગ્ય સર્જન પાસે ઓપરેશન કરાવવાથી જીવનું જોખમ નહિવત રહે છે.

### સૌજન્ય




**ડૉ. વાયબ સી શાહ**  
ન્યૂરો અને સ્પાઈન સર્જન  
MS, MCh (Neuro)  
(મો) ૯૧-૯૮૨૪૦ ૩૭૧૩૭

## કીડની - આપણો પ્રખર રસાયણશાસ્ત્રી

કીડની આપણા શરીરનું જુવંત અંગ છે, તેના વગર આપણું અસ્તિત્વ શક્ય નથી, તેથી જ જ્યારે કીડની ફેરફાર (નિષ્ઠિય) થઈ જાય તો દર્દીને ડાયાલિસિસ કે કીડની પ્રત્યારોપણ (Kidney Transplantation) નો સહારો લેવો પડે છે.

સામાન્ય રીતે બે કીડની ઉદ્દરના ઉપરના ભાગમાં પાછળની બાજુએ મણકાની આજુબાજુ ગોઠવાયેલી હોય છે અને પાંસળીઓ વડે સુરક્ષિત રહે છે. ૭૦૦ માંથી એક વ્યક્તિને માત્ર એક કીડની હોય છે. જો તેનું બંધારણ સામાન્ય (Normal) હોય તો એક કીડની વડે પણ વ્યક્તિ સામાન્ય જીવન જીવી શકે છે. તેથી જ તો અમે જ્યારે કોઈ દર્દીની બંન્ધે કીડની ફેરફાર હોય તો તેના સ્વજનને કીડની દાન (Donation) માટે સમજાવીએ છીએ. કીડની દાતા અને કીડની ના દર્દી બંન્ધે એક એક કીડની વડે સામાન્ય જીવન જીવી શકે છે.



કીડનીનું મુખ્ય કાર્ય લોહીના શુદ્ધિકરણનું છે. હૃદયના દરેક ધબકારા વખતે હૃદયમાંથી ૨૦% લોહી મુઢી જેટલી કીડનીમાં જાય છે અને દરેક કીડનીમાં આવેલા ૧૦ લાખ ઘટકો (નેફ્રોન) વડે તેનું શુદ્ધિકરણ થાય છે, એટલે કે શરીરમાં ચચાપચચણી ક્રિયા દરમિયાન ઉત્પન થયેલા વિષદ્રવ્યોનો પેશાબ દ્વારા નિકાલ થાય છે. ૨૪ કલાકમાં લગભગ ૧૭૦ લિટર લોહીનું શુદ્ધિકરણ થાય છે અને તેમાંથી ૧ થી ૨ લિટર પેશાબ બને છે, આ ઉપરાંત કીડની શરીરમાં ક્ષાર-પાણીનું પણ નિયમન કરે છે અને શરીરમાં ઓછાવતા પ્રમાણમાં પાણી કે સોડિયમ હોય તો પણ શરીરનું રાસાયણિક બંધારણ જાળવી રાખે છે તેથી જ કીડનીને શરીરનો Master Chemist (પ્રખર રાસાયણ શાલી) કર્ણેવાય છે તદ્વિરાંત કીડની અંતઃઆવી ગ્રંથિ તરીકે પણ કાર્ય કરે છે અને રેનીનએન્જ્યોટેન્સિન (Renin-Angiotension) આલ્ડોસ્ટેરોન (Aldosterone system) પ્રોસ્ટાગલાડિન, કાઇનીન, એરીથ્રોપોએટીન અને વીટામીન ડી નું પણ નિયમન કરે છે. તેથી જ જ્યારે કીડની નિષ્ઠિય થાય ત્યારે એરીથ્રોપોએટીન અને એકટીવ વીટામીન ડી (Active Vitamin D) ને ઔષધરૂપે આપવામાં આવે છે.

તેવું જ બીજું અગત્યનું કામ પેનક્રિયાસ (Pancreas) ને લોહીની શર્કરા (Sugar) ના નિયમનમાં અનેકવિદ્ય રૂપે મદદરૂપ થવાનું છે. આવી આશ્ર્યજનક (Amazing) કીડનીની સુરક્ષા માટે આપણે નીચેના ૮ નિયમોનું પાલન અવશ્ય કરવું જોઈએ.

- (૧) શરીરનું સ્વાસ્થ્ય જાળવો અને બેઠાડું જીવન ટાળો.
- (૨) સંપૂર્ણ આહારનું સેવન કરો, બહારનો ખોરાક (Junk Food) શક્ય હોય તેટલો ટાળો
- (૩) ૩૦ વર્ષ પછી પ્રતિવર્ષ Blood Sugar (લોહીની શર્કરા) મપાવો અને જો મધુપ્રમેછ હોય તો તેની ખોરાક, કસરત અને ઔષધો વડે નિયમન કરો.
- (૪) બ્લડ પ્રેસર (રકત ચાપ), દર છ મહિને મપાવો અને તેની મર્યાદા કરતાં વધારે હોય તો નિયમિત કસરત, ખોરાકમાં મીઠા (નમક) નું નિયમન અને ઔષધો વડે કાબૂમાં રાખવો. મધુપ્રમેછ અને હાઈ બ્લડ પ્રેસર બંન્ધે Life Style (જીવન પદ્ધતિ) ના રોગો કર્ણેવાય છે અને Hurries (દોડધામ) Worries (ચિંતાઓ) અને Curries (નમકિન અને મસાલાવાળો ખોરાક) થી તે રોગ થાય છે માટે તેનાથી છૂટકારો મેળવો.
- (૫) રોજ પાણી અને અન્ય પ્રવાહીનું ચોગ્ય પ્રમાણમાં સેવન કરો. આપણા ગરમ દેશોમાં લગભગ ૩ લીટર પ્રવાહી લેવું જોઈએ.
- (૬) તમાકુ (કોઈપણ પ્રકારમાં) અને અન્ય વ્યસનોનો ત્યાગ કરો, તેઓ સીધી કે આડકતરી રીતે કીડનીને નુકશાન કરતા હોય છે.
- (૭) પીડાશામક (Pain Killer) અને અન્ય ઔષધોનો આડેદાદ ઉપયોગ ન કરો, ડોક્ટરની સલાહ પ્રમાણે જ તેનું સેવન કરો.
- (૮) ૩૦ વર્ષ ની ઉંમર પછી પ્રતિ વર્ષ ( દા.ત ૪૫ દિવસે ) શારીરીક તપાસ (Body Check Up) કરાવો, તેથી કીડનીના રોગ શરૂઆતમાં જ પકડી શકાય અને તેને આગામ વધતો અટકાવી શકાય.

કીડની અને કીડનીના રોગો વિશે વધુ માહિતી મેળવવા

### સૌજન્ય



#### ડૉ. પંકજ શાહ

સીનિયર નેફ્રોલોજિસ્ટ

DNB(Nephrology)FISOT(Transplantation),  
FRCP(London)

(મો) ૯૧-૯૯૯૯૯૯૦૯૪

## લીવર ટ્રાન્સપ્લાન્ટ: માન્યતાઓ અને હકીકતો

લિવર ટ્રાન્સપ્લાન્ટ એ જુવન બચાવવાની પ્રક્રિયા છે જેમાં દાતાના સ્વરથ્ય યકૃત સાથે રોગગ્રસ્ત યકૃતને બદલવાનો સમાવેશ થાય છે. જ્યારે લીવર લીવર ટ્રાન્સપ્લાન્ટ એક જ ટિલ અને જોખમી પ્રક્રિયા હોઈ શકે છે, તે ધણીવાર લીવર ફેલ્યોર, લીવર કેન્સર અને અન્ય ગંભીર લીવર રોગો ધરાવતા લોકો માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. જો કે, લીવર ટ્રાન્સપ્લાન્ટ વિશે ધણી માન્યતાઓ અને ગેરમાન્યતાઓ છે જે લોકોને આ જુવનરક્ષક સારવાર મેળવવાથી રોકી શકે છે. આ લેખમાં, અમે કેટલીક સામાન્ય માન્યતાઓનું અન્યેષણ કરીશું અને લીવર ટ્રાન્સપ્લાન્ટ વિશેના તથ્યો પ્રદાન કરીશું.

**માન્યતા (૧)** લિવર ટ્રાન્સપ્લાન્ટ માત્ર એવા લોકો માટે છે કે જેમણે આલ્કોહોલ અથવા ડ્રગ્સનો દુરૂપયોગ કર્યો છે.

**હકીકત:** જ્યારે આલ્કોહોલનો દુરૂપયોગ અને ડ્રગનો ઉપયોગ યકૃત રોગ તરફ દોરી શકે છે, ત્યાં યકૃત રોગના અન્ય ધાણા કારણો છે, જેમાં આનુવંશિક પરિબળો, ચેપ, સ્વયંપ્રતિરક્ષા વિકૃતિઓ અને મેટાબોલિક વિકૃતિઓનો સમાવેશ થાય છે. લિવર ટ્રાન્સપ્લાન્ટ માત્ર એવા લોકો માટે જ નથી કે જેમણે આલ્કોહોલ અથવા ડ્રગ્સનો દુરૂપયોગ કર્યો છે. વાસ્તવમાં, લીવર ટ્રાન્સપ્લાન્ટ મેળવનારા ધાણા લોકોને પદાર્થના દુરૂપયોગથી કચારેય કોઈ સમસ્યા થઈ નથી.


**માન્યતા (૨)** લીવર ટ્રાન્સપ્લાન્ટ એક ખતરનાક અને જોખમી પ્રક્રિયા છે.

**હકીકત:** લીવર ટ્રાન્સપ્લાન્ટ એ મુખ્ય સર્જિકલ પ્રક્રિયા છે, પરંતુ તે સામાન્ય રીતે સલામત અને અસરકારક છે. છેલ્લા કેટલાક દાયકાઓમાં લીવર ટ્રાન્સપ્લાન્ટની સફળતાના દરમાં નોંધપાત્ર સુધારો થયો છે, અને જટિલતાઓનું જોખમ પ્રમાણમાં ઓછું છે. જો કે, કોઈપણ સર્જિકલ પ્રક્રિયાની જેમ, ચેપ, રક્તશોધ અને નવા યકૃતને નકારવા સહિતના જોખમો સામેલ છે.

**માન્યતા (૩)** જો તમારી ઊંમર મોટી હોય અથવા અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ હોય તો તમે લિવર ટ્રાન્સપ્લાન્ટ કરાવી શકતા નથી.

**હકીકત:** ઊંમર અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ કોઈ વ્યક્તિને લિવર ટ્રાન્સપ્લાન્ટ કરાવતા અટકાવે તે જરૂરી નથી. લીવર ટ્રાન્સપ્લાન્ટ કરાવવાનો નિર્ણય વિવિધ પરિબળો પર આધાર રાખે છે, જેમાં લીવર રોગની ગંભીરતા, દર્દીનું એકંદર આરોગ્ય અને દાતા લીવરની ઉપલબ્ધતાનો સમાવેશ થાય છે. જ્યારે વૃદ્ધ દર્દીઓ અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ ધરાવતા લોકોને પ્રક્રિયા દરમિયાન વધુ જોખમોનો સામનો કરવો પડી શકે છે, આ કેટેગરીના ધાણા લોકોએ સફળતાપૂર્વક લિવર ટ્રાન્સપ્લાન્ટ કરાયું છે અને આરોગ્યના સુધારેલા પરિણામોનો અનુભવ કર્યો છે.

**માન્યતા (૪)** તમે લિવર ટ્રાન્સપ્લાન્ટ પ્રાક્ત કરી શકતા નથી જો તમે તે રાજ્યના નાગરિક નથી જ્યાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી રહ્યું છે.



**હકીકત:** લિવર ટ્રાન્સપ્લાન્ટ કોણ મેળવી શકે તે નક્કી કરવા માટે નાગરિકતા એ પરિબળ નથી. જો કે, લિવર ટ્રાન્સપ્લાન્ટ મેળવવા માટે બીજા દેશમાં મુસાફરી કરતા દર્દીઓ માટે અમુક લોજિસ્ટિકલ અને નાણાકીય વિચારણાઓ હોઈ શકે છે. વધુમાં, કેટલાક દેશોમાં લીવર ટ્રાન્સપ્લાન્ટ માટે અલગ-અલગ પાત્રતા માપદંડો હોઈ શકે છે.

**માન્યતા (૫)** લીવર ટ્રાન્સપ્લાન્ટ પછી તમે સામાન્ય જુવન જુવી શકતા નથી.

**હકીકત:** જ્યારે લીવર ટ્રાન્સપ્લાન્ટ પછી પુનઃપ્રાસ્તિનો સમયગાળો હોય છે, ત્યારે ધાણા લોકો પ્રક્રિયા પછી સામાન્ય, સ્વસ્થ જુવન જુવવામાં સક્ષમ હોય છે. યોગ્ય કાળજી અને દેખરેખ સાથે, મોટા ભાગના લોકો કે જેમણે લિવર ટ્રાન્સપ્લાન્ટ કરાયું છે તેઓ કામ, મુસાફરી અને કસરત સહિત તેમની સામાન્ય પ્રવૃત્તિઓમાં પાછા કરવા સક્ષમ છે.

નિષ્કર્ષમાં, લીવર ટ્રાન્સપ્લાન્ટ વિશે ધણી માન્યતાઓ અને ગેરમાન્યતાઓ છે જે લોકોને આ જુવન-રક્ષક સારવાર મેળવવાથી રોકી શકે છે. લીવર ટ્રાન્સપ્લાન્ટ વિશેના તથ્યોને સમજુને, લોકો તેમના સ્વાસ્થ્ય વિશે માહિતગાર નિર્ણયો લઈ શકે છે અને તેમના યકૃત રોગને સંચાલિત કરવા માટે જરૂરી કાળજી મેળવી શકે છે. જો તમને અથવા કોઈ પ્રિય વ્યક્તિને લિવર ટ્રાન્સપ્લાન્ટની જરૂર હોય, તો આ જુવન બદલાતી પ્રક્રિયા વિશે વધુ જાણવા માટે તમારા ડોક્ટર સાથે વાત કરો.

### સૌઝન્ય



**ડૉ. વિકાસ ડી. પટેલ**

એચેપીબી સર્જરી અને લિવર ટ્રાન્સપ્લાન્ટેશન

MBBS, MS (General Surgery)

Fellowship in Abdominal Organ Transplant Surgery (IKDRC-ITS)

(મો) ૯૧-૯૯૨૫૧ ૪૧૫૬૨

## મેરિંગો સિમ્સ હોસ્પિટલ, અમદાવાદ



### ભારતની સૌથી મોટી અને નિષ્ણાત હાર્ટ કેર ટીમમાંની ઓક

**મુખ્ય હોરોણ ડાબે થી જમણો :** ડૉ. વિપુલ આહિર | ધનયતા ધોળકિયા | ડૉ. ચિંતાન શેડ | ડૉ. નિરેન ભાવસાર | ડૉ. નિકુંજ વ્યાસ | ડૉ. શોનક શાહ | ડૉ. દીરેન શાહ  
ડૉ. ધવલ નાયક | ડૉ. અમિત ચંદન | ડૉ. પ્રણાવ મોટી | ડૉ. કિશોર ગુલા | ડૉ. હિરેન ધોળકિયા | ઉલ્હાસ પટિયાર | આકાશ રાજાવત | ડૉ. ગુણાવંત પટેલ  
**બીજી હોરોણ ડાબે થી જમણો :** ડૉ. તેજશ વી. પટેલ | ડૉ. સત્યા ગુપ્તા | ડૉ. ઉર્મિલ શાહ | ડૉ. અનિશ ચંદારાણા | ડૉ. કેયૂર પરીખ | ડૉ. મિલન ચગ  
ડૉ. અજય નાઈક | ડૉ. હેમાંગ બખી | ડૉ. હિરેન કેવડીયા | ડૉ. વિપુલ કપૂર | ડૉ. કશ્યપ શેડ

**કાર્ડિયાક MRI | 4-D ECHO | સીટી કોરોનરી એન્જ્યુયોગ્રાફી | OCT | IVUS | FFR**  
**EP, પેસમેકર્સ, CRT/D, ICD, 3-D કાર્ટો માટે શ્રેષ્ઠ હોસ્પિટલ**

#### ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજી:

- કોરોનરી એન્જ્યુયોગ્રાફી • કોરોનરી એન્જ્યુયોપ્લાસ્ટી • પેરીફેરલ અને કેરોટીચ એન્જ્યુયોપ્લાસ્ટી • હાર્ટ ફેલ્યોર માટે ડિવાઇસ થેરાપી
- બલુન વાલ્વ્યુલોપ્લાસ્ટી • TAVI/TAVR જેવા સરંયનાત્મક હૃદયના રોગો માટે પકર્યુટેનિયસ ઇન્ટરવેન્શન • ઈલેક્ટ્રોફિઝિયોલોજી સ્ટડીઝ
- લેફ્ટ વેન્ટ્રિક્યુલર આસિસ્ટ ડિવાઇસ (LVAD) ઇમ્લાન્ટેશન

#### રોગ-વિશિષ્ટ કિલનિકસ:

- હાર્ટ ટ્રાન્સપાન્ટ કિલનિક
- CIMS STEMI પટેલ
- સ્ટ્રક્ચરરલ અને વાલ્વ્યુલર કિલનિક અને સ્ટ્રોક સેન્ટર
- CIMS હાર્ટ ફેલ્યોર કિલનિક
- એરિથમિયા કિલનિક
- કાર્ડિયો-ઓક્ઝોલોજી કિલનિક

**1827**

કોરોનરી એન્જ્યુયોપ્લાસ્ટી  
અને સ્ટેન્ટીંગ

(જાન્યુઆરી થી ડિસેમ્બર ૨૦૨૨)

હોસ્પિટલ દ્વારા ૮૮% સફળ પરિણામો

ગુજરાતની ખાનગી હોસ્પિટલોમાં સૌથી વધુ

**ટ્રંક સમયમાં(૪) ચોથી કેથલેબ**



અમેરિકન કોલેજ ઓફ કાર્ડિયોલોજી (ACC)

સેન્ટર ઓફ એક્સેલન્સ

ભારતમાં પ્રથમ પેકી ઓક

**1000**

થી પણ વધારે  
ઓપન હાર્ટ સર્જરી

(જાન્યુઆરી થી ડિસેમ્બર ૨૦૨૨)

CIMS News Care & Cure Registered under **RNI No. GUJBIL/2010/39100**

Published 25<sup>th</sup> of every month

Registered under Postal Registration No. **GAMC-1813/2023-2025** valid upto 31<sup>st</sup> December, 2025  
 issued by SSPO's Ahmedabad City Division, permitted to post at Ahmedabad PSO on 30<sup>th</sup> to 5<sup>th</sup> of every month  
 Licence to Post Without Prepayment No. **PMG/NG/107/2023-2025** valid upto 31<sup>st</sup> December, 2025

If Undelivered Please Return to

**Marengo CIMS Hospital**

Nr. Shukan Mall, Off Science City Road,  
 Sola, Ahmedabad-380060.

Call : 1800 309 9999

Subscribe "CIMS News Care & Cure" : Get your "CIMS News Care & Cure", the information of the latest medical updates only ₹ 60/- for one year. To subscribe pay ₹ 60/- in cash or cheque/DD at CIMS Hospital Pvt. Ltd. Nr. Shukan Mall, Off Science City Road, Sola, Ahmedabad-380060. Phone : +91-79-4805 2823. Cheque/DD should be in the name of : "**CIMS Hospital Pvt. Ltd.**"  
 Please provide your **complete postal address with pincode, phone, mobile and email id** along with your subscription

**04<sup>th</sup>**

**TMVR**

ટ્રાન્સકેરેટર મિટ્રલ વાલ્વ  
રિપ્લેસમેન્ટ



બલૂન એક્સપાન્ડલ વાલ્વ

**33<sup>rd</sup>**

**TAVI**

ટ્રાન્સકેરેટર એઓર્ટિંગ  
વાલ્વ ઇમ્પ્લાન્ડેશન



બલૂન  
એક્સપાન્ડલ વાલ્વ



સેલ્ફ એક્સપાન્ડલ  
સુપ્રા એન્યુલર વાલ્વ

જુધવાર, ૭મી જૂન, ૨૦૨૩

**ગુજરાતમાં સૌથી વધુ**  
૧૦૦% સફળ હોસ્પિટલ પરિણામો

**ભારતના શ્રેષ્ઠ હાર્ટ કેર નિષ્ણાતો**

## **MARENGO CIMS HOSPITAL, AHMEDABAD LEADER ACROSS INDIA IN TRANSPLANTS**

**2<sup>nd</sup>**

LUNG TRANSPLANT



**44<sup>th</sup>**

LIVER TRANSPLANT



**203<sup>rd</sup>**

BONE MARROW  
TRANSPLANT



**41<sup>st</sup>**

HEART TRANSPLANT



**63<sup>rd</sup>**

KIDNEY TRANSPLANT



For emergency or appointment,  
**1800 309 9999**

CIMS Hospital : Regd Office: Plot No.67/1, Opp. Panchamrut Bunglows, Nr. Shukan Mall, Off Science City Road,  
 Sola, Ahmedabad - 380060. Ph. : +91-79-2771 2771-72

CIMS Hospital Pvt. Ltd. | CIN : U85110GJ2001PTC039962 | [marengocims.info@marengocims.com](mailto:marengocims.info@marengocims.com) | [www.cims.org](http://www.cims.org)

Printed, Published and Edited by Preeta Chag on behalf of the CIMS Hospital  
 Printed at High Scan Pvt. Ltd., 'Hi Scan Estate', Sarkhej-Bavla Highway, Changodar. Ahmedabad-382 213.  
 Published from CIMS Hospital, Nr. Shukan Mall, Off Science City Road, Sola, Ahmedabad-380060.